

Stovec Industries Ltd.

Regd. Office and Factory:

N.I.D.C., Near Lambha Village, Post Narol,

Ahmedabad – 382 405, INDIA

CIN : L45200GJ1973PLC050790

Telephone : +91 79 6157 2300

+91 79 25710407 to 410

Fax : +91 79 25710 406

E-mail : admin@stovec.com

To,
The Corporate Relations Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400 001

Reference : Scrip Code No.: - 504959
Date : March 10, 2021
Subject : Newspaper Advertisement for the transfer of Equity Shares to
Investor Education and Protection Fund ("IEPF") Authority



Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Please find enclosed copy of newspaper advertisement for Notice of Mandatory transfer of Equity Shares of the Company to the Demat Account of IEPF, published on March 10, 2021 in Business Standard (English) and Jaihind (Gujarati).

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,

For Stovec Industries Limited



Sanjeev Singh Sengar
Company Secretary & Compliance Officer

Encl.: As above

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE

NOTICE is hereby given that the share certificate Nos. 28316 to 28318 for total 125 shares registered under Folio No. 17777 standing in the name(s) of Late Mrs. Sudesh Krishna Lal Kapoor of Gujarat Namada Valley Fertilizers & Chemicals Ltd. (GNFC Ltd) have been reported lost. Further, the shares have already been transferred to Investor Education & Protection Fund (IEPF) Authority as per the rules made therefore. We have, as legal heir of the deceased shareholder, submitted an application with the Company at its Investor Service Centre, GNFC Ltd., P.O. Namadanager-392015, Dist. Bharuch, Gujarat requesting to issue us procedure to claim the said shares from IEPF Authority.

Objection, if any, in the above matter with respect to the aforesaid share certificates must be filed with the Company at the address mentioned above supported by documentary evidence, within 15 days of the date of this advertisement. The Company will, thereafter, proceed to intimate the procedure to claim the shares from IEPF Authority.

The public are cautioned against dealing in any way with these shares.

Date: 10-03-2021

Rajesh Kapoor
A 17/2 Acharya Niketan,
Mayur Vihar -1, New Delhi - 110092

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE

NOTICE is hereby given that the share certificate Nos. 28319 to 28321 for total 125 shares registered under Folio No. 17778 standing in the name of Late Mr. Krishna Lal Kapoor of Gujarat Namada Valley Fertilizers & Chemicals Ltd. (GNFC Ltd) have been reported lost. Further, the shares have already been transferred to Investor Education & Protection Fund (IEPF) Authority as per the rules made therefore. We have, as legal heir of the deceased shareholder, submitted an application with the Company at its Investor Service Centre, GNFC Ltd., P.O. Namadanager-392015, Dist. Bharuch, Gujarat requesting to issue us procedure to claim the said shares from IEPF Authority.

Objection, if any, in the above matter with respect to the aforesaid share certificates must be filed with the Company at the address mentioned above supported by documentary evidence, within 15 days of the date of this advertisement. The Company will, thereafter, proceed to intimate the procedure to claim the shares from IEPF Authority.

The public are cautioned against dealing in any way with these shares.

Date: 10-03-2021

Rajesh Kapoor
A 17/2 Acharya Niketan,
Mayur Vihar -1, New Delhi - 110092

NOTICE-CUM-ADDENDUM

REVISION IN PRODUCT LABELLING IN THE EXISTING SCHEMES OF KOTAK MAHINDRA MUTUAL FUND

Pursuant to SEBI Circular No. SEBI/HO/MD/DF3/CR/P/2020/197 dated October 05, 2020 on Product Labeling in Mutual Fund, Kotak Mahindra Mutual Fund has evaluated the risk levels for the schemes of the Mutual Fund based on the scheme portfolios as on February 28, 2021.

Accordingly, the existing product label, as mentioned in the respective Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) (including application form), of the following Schemes of Kotak Mahindra Mutual Fund are hereby revised with the product label as given below.

Scheme Name	Existing Riskometer	Revised Riskometer
Kotak Bond Short Term Fund		
Kotak FMP Series 220		

All other terms and conditions of the Scheme Information Document (SID) Key Information Memorandum (KIM) of the schemes remain unchanged. This addendum forms an integral part of the SID / KIM of the Schemes, as amended from time to time.

For Kotak Mahindra Asset Management Company Limited
Investment Manager - Kotak Mahindra Mutual Fund
Mumbai
March 09, 2021

Nilesh Shah
Managing Director

Any queries / clarifications in this regard may be addressed to:
Kotak Mahindra Asset Management Company Limited
CIN: 165991MH1994PLC030009 (Investment Manager for Kotak Mahindra Mutual Fund)
6th Floor, Kotak Towers, B-10, No. 21, Amal Park, Gandhinagar, Gandhinagar - Muzium Link Road, Madad (East), Mumbai 400097. Phone Number: 022 - 66058225 • Email: mutual@kotak.com • Website: assetmanagement.kotak.com

Mutual Fund Investments are subject to market risks, read all scheme related documents carefully.

Mutual Funds
Aditya Birla Sun Life Mutual Fund

ADITYA BIRLA CAPITAL
P R O T E C T I N G I N V E S T M E N T F I N A N C I N G S A V I N G S

Aditya Birla Sun Life AMC Limited (Investment Manager for Aditya Birla Sun Life Mutual Fund) Registered Office: One World Center, Tower 1, 17th Floor, Jhuleli Mill Compound, 841, 5B, Marg, Eghatstone Road, Mumbai - 400 013. Tel: 4356 8000 Fax: 4356 8110/1111 CIN: 165991MH1994PLC 098311

A. Record Date for Dividend

NOTICE IS HEREBY GIVEN THAT the Trustees of Aditya Birla Sun Life Mutual Fund have approved Monday, March 15, 2021*, as the Record Date for declaration of dividend subject to availability of distributable surplus on the Record Date, in the following schemes:

Name of the Schemes	Plans/Options	Dividend Rate [₹ per unit # on face value of ₹ 10/- per unit (except for Aditya Birla Sun Life Banking & PSU Debt Fund - face value of ₹ 100/- per unit)]	NAV as on March 08, 2021(₹)
Aditya Birla Sun Life Short Term Fund (An open ended short term debt scheme investing in instruments such that the Macaulay duration of the portfolio is between 1-3 years)	Regular Plan - Quarterly Dividend Option	0.1317	10.6746
	Direct Plan - Quarterly Dividend Option	0.1354	10.9993
Aditya Birla Sun Life Medium Term Plan (An open ended medium-term debt scheme investing in instruments such that the Macaulay duration of the portfolio is between 3-4 years)	Regular Plan - Quarterly Dividend Option	0.1249	10.3676
	Direct Plan - Quarterly Dividend Option	0.1268	10.5314
	Regular Plan - Half Yearly Dividend Option	0.2478	10.5785
Aditya Birla Sun Life Banking & PSU Debt Fund (An open ended debt scheme predominantly investing in debt instruments of banks, Public Sector Undertakings, Public Financial Institutions and Municipal Bonds)	Regular Plan - Quarterly Dividend Option	1.3615	109.8907
	Direct Plan - Quarterly Dividend Option	1.3886	112.1684
Aditya Birla Sun Life Government Securities Fund (An open ended debt scheme investing in government securities across maturity)	Regular Plan - Quarterly Dividend Option	0.1424	11.3388
	Direct Plan - Quarterly Dividend Option	0.1473	11.7480
Aditya Birla Sun Life Income Fund (An open ended medium term debt scheme investing in instruments such that the Macaulay duration of the portfolio is between 4-7 years)	Regular Plan - Quarterly Dividend Option	0.1673	13.3461
	Direct Plan - Quarterly Dividend Option	0.1761	14.0591

The NAV of the schemes, pursuant to pay out of dividend would fall to the extent of payout and statutory levy (if applicable).

As reduced by the amount of applicable statutory levy, *or the immediately following Business Day if that day is a non-business day.

All unitholders whose names appear in the Register of Unitholders / Beneficial owners under the dividend options of the said schemes as at the close of business hours on the Record Date shall be eligible to receive the dividend so declared.

B. Addendum No. 07/2021

Notice-cum-Addendum to the Scheme Information Document ("SID") and Key Information Memorandum ("KIM") of Aditya Birla Sun Life Regular Savings Fund

Change in the Risk-o-meter

NOTICE IS HEREBY GIVEN THAT, pursuant to SEBI circular no. SEBI/HO/MD/DF3/CR/P/2020/197 dated October 5, 2020, the Risk-o-meter of the following Scheme has been revised as under:

Scheme Name	Risk-o-meter
Aditya Birla Sun Life Regular Savings Fund (An open ended hybrid scheme investing predominantly in debt instruments)	

The above Risk-o-meter is based on evaluation of risk level of the Scheme's monthly portfolio as at February 28, 2021.

All other details of the Product Labeling and all other features and terms & conditions of the SID and KIM of the Scheme will remain unchanged.

This Notice-cum-Addendum forms an integral part of the SID and KIM issued for the Scheme read with the addenda issued thereunder.

For Aditya Birla Sun Life AMC Limited
(Investment Manager for Aditya Birla Sun Life Mutual Fund)
Sd/-
Authorized Signatory

Date : March 09, 2021
Place : Mumbai

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

STOVEC INDUSTRIES LIMITED

Regd. Office: N.I.D.C., Nr. Lambha Village, Post: Narol, Ahmedabad - 382405, Gujarat
Tel: +91 (0) 79 6157 2300, Fax: +91 (0) 79 2571 0406, E-mail: secretarial@stovec.com
CIN : L45200GJ1973PLC050790 Website: www.stovec.com

NOTICE
(For the attention of Equity Shareholders of the Company)

Mandatory transfer of Equity Shares of the Company to the Demat Account of Investor Education and Protection Fund ("IEPF")

This Notice is being published pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time ("the said Rules"). As per Section 124 (b) of the Companies Act, 2013 read with the said Rules, all shares in respect of which dividends has not been claimed/ paid for seven consecutive years or more are required to be transferred by the Company to the Investor Education and Protection Fund ("IEPF").

In accordance with the said Rules, the Company has communicated individually to all such shareholders at their address registered with the Company, whose shares are liable to be transferred to IEPF under the said rules for their appropriate action.

The Company has also uploaded the details of such shareholders and the corresponding shares due for transfer to the Demat Account of IEPF, on its website at www.stovec.com. The Shareholders are requested to visit the Company's website to verify the details of the Unclaimed Dividends and the Shares liable to be transferred to the Demat Account of IEPF. Shareholders who have not claimed their dividends pertaining to the financial year 2013 onwards are requested to claim their Dividends expeditiously. In case the Shareholders fail to claim the above Unclaimed Dividend on or before June 09, 2021, the Company will proceed to transfer the underlying Equity Shares of the Company, registered in the name of the Shareholders to the credit of the Demat Account of IEPF pursuant to the said Rules.

Shareholders may please note that all future dividend (if any) and other corporate benefits (if any) on the said shares shall be credited to the IEPF. Shareholders may further note that both the Unclaimed Dividend and the corresponding Shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed back by Shareholders from the IEPF Authority after complying with the procedure as set out in the said Rules.

The concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing New Share Certificate(s) in lieu of the Original Share Certificate(s) held by Shareholder(s) for the purpose of transfer of such shares to IEPF as per the Rules (as amended from time to time) and upon such issue, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. Further, the concerned shareholders who are holding shares in dematerialized form and whose shares are liable to be transferred to IEPF may note that Company would be issuing instruction(s) to Depositories by way of Corporate Action for the purpose of transfer of their shares to IEPF.

The Shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed to be adequate notice in respect of issue of New Share Certificate(s) by the Company and issuing of instruction(s) to Depositories for the purpose of transfer of shares to IEPF, pursuant to the said Rules.

In case of any queries, please contact the Company's Registrar and Share Transfer Agent, M&L Link Intime India Private Limited, at their following address/e-mail/telephone number.

Link Intime India Pvt. Ltd., Unit: Stovec Industries Ltd., 5th Floor, 506 to 508, Amambah Business Center-I, (ABC-I) Beside Gala Business Center, Nr. St. Xavier's College Corner, Off C.S. Road, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat. Telefax: +91 (0) 79 2646 5179/86, E-mail: apl.shares@linkintime.co.in Website: www.linkintime.com

Date : March 09, 2021
Sd/-
Sanjeev Singh Sengar
Company Secretary

HINDUJA HOUSING FINANCE

Corporate Office: No. 27/A, Developed Industrial Estate, Guindy, Chennai, Tamilnadu-600032, Branch Office: 3rd Floor, IFCO Building, 8th, Naroli Complex, 8th, Pinnac Garden, Nr. Shivrajnagar Cross Road, Satellite - Ahmedabad - 380015 Authorized Officer: Mr. Jivan Bhat, M. +919825263663 E-mail: jivan.bhat@hindujahousingfinance.com

Possession Notice - As per Appendix 4 (for immovable property)

Whereas the undersigned action under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under Section 13(1)(2) read with rule 3 of Security Interest Enforcement Rules 2002, issued demand notice u/s 13(2) in the below following accounts Borrower(s)/Guarantor(s) the dates mentioned hereunder, calling upon Borrower(s)/ Guarantor(s) to repay the amount mentioned in the respective demand notice within 60 days from the date of notice.

The Borrower(s)/Guarantor(s) having failed to repay the amount mentioned in notice, notice is hereby given to the respective Borrower(s)/ Guarantor(s) and public in general that the undersigned has taken Possession of the Property Described herein below in exercise of powers upon him under Section 13(4) of said Act read with rule 9 of Security Interest (Enforcement) Rules 2002 on dates mentioned against each account.

The Borrower(s)/Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with property and any dealing with the property will be subject to the charge of Hinduja Housing Finance Ltd. for amount mentioned herein below besides interest and other charges/expenses against this each account.

The Borrower(s)/Guarantor(s) attention is invited to provisions of sub-section (8) of Section 13 of Act with respect to time available to redeem the secured assets.

Sr. No.	Name of the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount and Loan Account No. & Branch	Date of Possession Notice & Type of Possession	SCHEDULE OF THE PROPERTY
1	Mr. Ashish Himatbhai Kachhadia (Borrower) Mr. Mayur Himatbhai Kachhadia (Co-Borrower)	02/09/2020 & Rs. 38,99,736/- & A/C No. GJ/AMDI/AHM/DIA/00000054 of Ahmedabad Branch	09/03/2021 Symbolic Possession	All parts and parcels of non-agriculture immovable Residential Plot No./ Bungalow No. 38 of Revenue Survey No. 187, admeasuring land area about 100.45 Sq. Mts. along with undivided share in Common Road and C.O.P. admeasuring about 57.49, total land admeasuring about 157.94 Sq. Mts., with construction thereon land about 213.677 Sq. Mts., situated in the scheme known as "SANT VILLA", at Mouje Village: Manipura, Taluka: Nadiad, District: Kheda and Registration District & Sub-District: Kheda, with boundaries as under: East: Plot/Bungalow No. 48, West: Road, North: Plot/Bungalow No. 38, South: Plot/Bungalow No. 40.
2	Mr. Prakash Laduram Choudhary (Borrower) Mrs. Lila Prakash Choudhary (Co-Borrower)	23/09/2020 & Rs. 15,91,246/- & A/C No. GJ/AMDI/AHM/DIA/00000178 of Ahmedabad Branch	04/03/2021 Symbolic Possession	All parts and parcels of non-agriculture immovable Residential 5th Floor Flat No. 504 of Block No. 9-H, in the scheme known as "Aagam 99 Residency Phase-2", admeasuring super build-up area about 90.30 Sq. Mts. along with undivided share admeasuring 40.46 Sq. Mts. in land of Revenue Survey No. 107(A)B+C, at Mouje Village: Sachana, Taluka: Viramgam, District: Ahmedabad and Sub-Registration District: Viramgam and Registration District: Ahmedabad with boundaries as under: East: Block & Block 9-D, West: Flat No. 9H-503, North: Road & Open Land, West: Flat No. 9H-501.
3	Mr. Rajiv Vanmalidas Mamtora (Borrower) Mrs. Saraswatiben Yantadas Mamtora (Co-Borrower)	23/09/2020 & Rs. 12,87,813/- & A/C No. GJ/AMDI/AHM/DIA/00000095 of Ahmedabad Branch	04/03/2021 Symbolic Possession	All parts and parcels of non-agriculture immovable Residential 1st Floor Flat No. B/8 in the scheme known as Rabul Apartment of Rabul (Vastirap) Association, admeasuring super build-up area about 71.76 Sq. Yds. i.e. 60.00 Sq. Mts. along with undivided share in land of City Survey No. 916, 917, 918 (Old City Survey No. 122, 123, 124) and Gram Panchayat House No. 315 palaki, bearing municipal number: 0673-26-0546-0001-C) at Mouje Village: Vastirap (Gaamtal), Taluka: Vejalpur, District: Ahmedabad & Sub-Registration District: Ahmedabad: 3 (Memnagar) & Registration District: Ahmedabad with boundaries as under: East: Other Property, West: Passage, North: Other Property, South: Flat No. 9.

Date : 10.03.2021
Place : Ahmedabad

Authorized officer
FOR, Hinduja Housing Finance Limited

